

February 12, 2021

BSE Limited Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai - 400 001 Company Code No.: 539807	National Stock Exchange of India Limited Exchange Plaza, Bandra Kurla Complex, Bandra (East), Mumbai - 400 051 Company Symbol: INFIBEAM
--	--

Dear Sir / Madam,

Sub: Newspaper Advertisements - Extraordinary General Meeting ("EGM") through Video Conferencing/ Other Audio Visual Means ("VC/OAVM") facility

In compliance with the Ministry of Corporate Affairs' General Circular No. 20/2020 dated May 05, 2020 and Regulation 47 and Regulation 30 read with Schedule III of SEBI (Listing Obligations Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of newspaper advertisements published in the Financial Express (English - National Daily All Editions) and Financial Express (Gujarati Edition) on Friday, February 12, 2021 inter-alia following matters have been published:


1. Intimating that the Extraordinary General Meeting of the Company will be held on Tuesday, March 09, 2021 at 10:00 a.m. through "VC/OAVM" facility.
2. Steps for registration / updating the email address by Members for obtaining EGM Notice of the Company and login process for joining the EGM through VC / OAVM and manner of casting vote(s) through e-voting.

We request you to kindly take the same on your records.

Thanking you,

Yours faithfully,

For Infibeam Avenues Limited



Shyamal Trivedi
Vice President & Company Secretary

Encl.: As above

INFIBEAM AVENUES LIMITED

(Formerly known as Infibeam Incorporation Limited)

Regd. Office: 28th Floor, GIFT Two Building, Block No. 56, Road-5C, Zone-5, GIFT CITY, Gandhinagar,
Taluka & District - Gandhinagar - 382 355, **CIN: L64203GJ2010PLC061366**

Tel: +91 79 67772204 | **Fax:** +91 79 67772205 | **Email:** ir@ia.ooo | **Website:** www.ia.ooo



INFIBEAM AVENUES LIMITED

[CIN: L64203GJ2010PLC061366]

Registered Office: 28th Floor, GIFT Two Building, Block No. 56, Road-5C, Zone-5, GIFT CITY, Gandhinagar, Taluka & District - Gandhinagar - 382 355

Tel: +91 79 67772204; **Fax:** +91 79 67772205 **Email:** ir@ia.000; **Website:** www.ia.000

NOTICE OF EXTRAORDINARY GENERAL MEETING OF THE COMPANY TO BE HELD THROUGH VIDEO CONFERENCE (VC)/OTHER AUDIO-VISUAL MEANS (OAVM)

NOTICE is hereby given that the Extraordinary General Meeting ("EGM") of the Members of Infibeam Avenues Limited ("the Company") will be held on Tuesday, March 9, 2021 at 10:00 a.m. IST through Video Conferencing (VC) / Other Audio Video Means (OAVM) to transact businesses as set out in the Notice of the EGM.

The said EGM will be convened in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and the Rules made thereunder; provisions of the Securities and Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing regulations"), the provisions of General Circular No. 14/2020 dated April 8, 2020; General Circular No. 17/2020 dated April 13, 2020; General Circular No. 20/2020 May 5, 2020 and General Circular No. 39/2020 dated December 31, 2020 Issued by the MCA and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 Issued by SEBI ("MCA and SEBI Circulars") in view of the continuing Covid-19 pandemic.

In accordance with the aforesaid Circulars, the Notice of EGM along with the explanatory statement pursuant to Section 102 of the Act will be sent only through electronic mode to all the members whose email addresses are registered with the Company/Depositories. The Notice of the EGM will also be available on the website of the Company at www.ia.000 and at www.nedl.co.in and on the website of the stock exchanges. Members can attend and participate in the EGM through VC/OAVM facility only. The instructions for joining the EGM will be provided in the Notice of the EGM. Participation of members through VC/OAVM will be reckoned for the purpose of quorum for the EGM as per section 103 of the Companies Act, 2013.

The Company is providing remote e-voting facility to all its Members to cast their votes on all resolutions set out in the Notice of the EGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the EGM. Detailed procedure for remote e-voting/ e-voting will be provided in the Notice of the EGM.

In case of a member whose e-mail address is not registered / updated with the Company / RTA / Depository Participant(s), please follow the following steps to register email address for obtaining EGM Notice of the Company and login details for e-voting:

- For members holding shares in Physical mode - please provide necessary details like Folio No., Name of shareholder by email to ir@ia.000.
- Members holding shares in Demat mode can get their E-mail ID registered by contacting their respective Depository Participant or by email to ir@ia.000.

The Notice of the EGM of the Company will be sent to the shareholders holding shares as on cut-off date for the dispatch in accordance with the applicable laws on their registered e-mail addresses in due course.

For Infibeam Avenues Limited

sd/-

Shyamal Trivedi

Vice President & Company Secretary

Place : Gandhinagar

Date : February 11, 2021



ઈન્ફીબીમ એવેન્યુસ લીમીટેડ

[CIN: L64203GJ2010PLC061366]
 રજીસ્ટર્ડ ઓફીસ : ૨૮મો માળ, ગ્રીફટ ૨ ટાવર, બ્લોક નં. ૫૬, રોડ-પક્ષી,
 ઝોન-૫, ગિફ્ટ સિટી, ગાંધીનગર, તાલુકો અને વિસ્ત્રો - ગાંધીનગર-૩૮૨ ૩૫૫
 ફોન : +૯૧ ૭૯ ૬૦૦૭૨૨૦૫, ફેક્સ : +૯૧ ૭૯ ૬૦૦૭૨૨૦૫
 ઇમેઇલ : info@ia.ooo, વેબસાઇટ : www.ia.ooo

વિડિચો કોન્ફરન્સ (વીસી) / અન્ય ઓડિયો - વિઝ્યુઅલ માધ્યમો (ઓએવીએમ) દ્વારા યોજનાર કંપનીની ખાસ સામાન્ય સભાની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે ઇન્ફીબીમ એવેન્યુસ લીમીટેડ (કંપની) ના સભ્યોની ખાસ સામાન્ય સભા (ઉચ્ચતમ) મંગળવાર, માર્ચ ૯, ૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વિડિચો કોન્ફરન્સિંગ (વીસી) / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો (ઓએવીએમ) દ્વારા ઉચ્ચતમની નોટીસમાં જણાવેલ કાર્યો પાર પાડવા માટે યોજાશે.

આ ઉચ્ચતમ કંપની કાયદા, ૨૦૧૭ ની લાગુ જોગવાઈઓ અને તે હેઠળ બનેલ નિયમો, સિસ્ટોરીટીઝ અને એક્સચેન્જ ઓફ ઓફ ઇન્ડિયા (સેબી) (સિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસ્ક્લોઝર રીક્વાયરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ (સિસ્ટીંગ ડેપ્યુલેશન્સ) ની જોગવાઈઓ અને કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખીને કોર્પોરેટ અર્કેસ મેનાલપ દ્વારા જારી કરાયેલ જનરલ સરસ્યુલર નં. ૧/૨૦૨૦ તા. ૮ એપ્રિલ, ૨૦૨૦, જનરલ સરસ્યુલર નં. ૧/૨૦૨૦ તા. ૧૦ એપ્રિલ, ૨૦૨૦, જનરલ સરસ્યુલર નં. ૨૦/૨૦૨૦ તા. ૫ મે, ૨૦૨૦ અને જનરલ સરસ્યુલર નં. ૦૯/૨૦૨૦ તા. ૦૧ ડિસેમ્બર, ૨૦૨૦ અને સેબી દ્વારા જારી કરાયેલ સરસ્યુલર નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨ મે, ૨૦૨૦ અને સરસ્યુલર નં. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 તા. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ (સરસ્યુલર) ની જોગવાઈઓના અનુવાદન હેઠળ બોલાવામાં આવી રહી છે.

ઉપરોક્ત સરસ્યુલર મુજબ, કંપની કાયદાની કલમ ૧૦૨ અન્વયે ઉચ્ચતમની નોટીસ તેમજ ખુલાસા નિવેદનો જે સભ્યોના ઉમેદવાર એગ્રેસ કંપની / ડિપોઝીટરી પાસે રજીસ્ટર્ડ છે તેમને ઇલેક્ટ્રોનિક રીતે મોકલવામાં આવશે. ઉચ્ચતમની નોટીસ કંપનીની વેબસાઇટ www.ia.ooo અને www.nsdl.co.in અને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવશે. સભ્યો કહત વીસી / ઓએવીએમ દ્વારા ઉચ્ચતમમાં હાજરી આપી શકે છે અને ભાગ લઈ શકે છે. ઉચ્ચતમમાં જોડાવા માટેની સુચનાઓ ઉચ્ચતમની નોટીસમાં આપવામાં આવશે. વીસી / ઓએવીએમ દ્વારા ભાગ લેનાર સભ્યોની કંપની કાયદા, ૨૦૧૭ ની કલમ ૧૦૦ મુજબ ઉચ્ચતમ માટે કોરમની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવશે.

કંપની તેના તમામ સભ્યોને ઉચ્ચતમની નોટીસમાં જણાવેલ તમામ કાર્યો પર તેમના મત આપવા માટે રીમોટ ઇ-વોટીંગની સવલત આપી રહી છે. વધુમાં, કંપની ઉચ્ચતમ દરમિયાન ઇ-વોટીંગ દ્વારા મતદાનની સવલત પણ પુરી પાડી રહી છે. રીમોટ ઇ-વોટીંગ / ઇ-વોટીંગ માટેની વિગતવાર પ્રક્રિયા ઉચ્ચતમની નોટીસમાં આપવામાં આવશે.

જે સભ્યોના નામ કંપની / સિંક ઇન્ટાઇમ / ડિપોઝીટરી પાર્ટીસીપન્ટ(ટી) પાસે રજીસ્ટર / સુચારો કરાવ્યા નથી, તેઓને કંપનીની ઉચ્ચતમ નોટીસ અને ઇ-વોટીંગની લોગીન વિગતો મેળવવા માટે ઉમેદવાર એગ્રેસ રજીસ્ટર કરવા માટે નીચેની પ્રક્રિયા અનુસરવા વિનંતી છે.

એ) ફિઝિકલ સ્વરૂપે શેર ધરાવતા સભ્યો માટે : info@ia.ooo પર ઉમેદવાર કરીને આવશ્યક વિગતો જેવી કે કોલિચો નંબર, શેરહોલ્ડરનું નામ જણાવવા વિનંતી છે.

બી) ડિજિટલ સ્વરૂપે શેરો ધરાવતા સભ્યો તેમના લાગતા વળગતા ડિપોઝીટરી પાર્ટીસીપન્ટનો સંપર્ક કરીને અથવા info@ia.ooo પર ઉમેદવાર કરીને તેમના ઉમેદવાર આઉટી રજીસ્ટર કરાવી શકે છે.

કંપનીની ઉચ્ચતમની નોટીસ કટ-ઓફ તારીખના રોજ શેરો ધરાવતા શેરહોલ્ડરોને તેમના રજીસ્ટર્ડ ઉમેદવાર આઉટી પર લાગુ કાયદાઓ મુજબ નિયત સમયે મોકલવામાં આવશે.

ઈન્ફીબીમ એવેન્યુસ લીમીટેડ વતી,

સ્થાન : ગાંધીનગર
 તારીખ : ફેબ્રુઆરી ૧૧, ૨૦૨૧

સહી/-
 શ્યામલ ત્રિવેદી
 વાઇસ પ્રેસિડેન્ટ અને કંપની સેક્રેટરી